

આઇસી15 ઇન્ડેક્સ 3,284 પોઇન્ટ ઘટ્યો

April 1, 2022



મુંબઈ: એક બાજુ અમેરિકામાં કુગાવો પ્રતિકૂળ બની રહ્યો છે ત્યારે બીજી બાજુ યુરોપિયન યુનિયનમાં ક્રીપ્ટોકરન્સી સંબંધે પ્રતિકૂળ કાયદો ઘડાયો હોવાને લીધે ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં ઘટાડો થયો છે.



યુરોપિયન યુનિયનના સત્તાધીશીએ એન્ટિ મની લોન્ડરિંગના નિયમો ઘડીને ક્રીપ્ટોકરન્સીમાં થતા પેમેન્ટ પર પ્રતિબંધ મૂકી દીધો છે.

અમેરિકામાં પર્સનલ કન્ઝમ્પ્શન પ્રાઇસ ઇન્ડેક્સ ફેબ્રુઆરીમાં વધીને 6.4 ટકા થઈ ગયો છે, જે તેની પહેલાંના મહિને 6 ટકા હતો. આ પરિબલને લીધે હવે ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં મોટો વધારો કરશે એવી ભીતિ સર્જાઈ છે. ફેબ્રુઆરી મહિનાનો કુગાવાનો આ દર 1982 બાદનો સર્વોચ્ચ દર છે.

બિટકોઇન શુક્રવારે બપોરે 4 ટકા ઘટીને 45,000 ડોલરની આસપાસ ચાલી રહ્યો હતો, જ્યારે ઈથેરિયમમાં પણ એટલો જ ઘટાડો થતાં ભાવ 3,200 ડોલર થયો હતો. અન્ય મોટા ઓલ્ટરનેટિવ કોઇન અને મીમ કોઇનના ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો છે.

દરમિયાન, ક્રીપ્ટોવાયરે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ - આઇસી15 શુક્રવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 4.70 ટકા (3,284 પોઇન્ટ) ઘટીને 66,457 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 69,741 ખૂલીને 69,891 સુધીની ઉપલી અને 65,293 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.

IC15 ઇન્ડેક્સની હિલચાલ

ખૂલેલો આંક	ઉપલો આંક	નીચલો આંક	બંધ આંક
69,741 પોઇન્ટ	69,891 પોઇન્ટ	65,293 પોઇન્ટ	66,457 પોઇન્ટ
ડેટાનો સમય: 1-4-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ)			



[અમને ફોલો કરો: [Facebook](#) | [Twitter](#) | [Instagram](#) | [Telegram](#)

તમારા મોબાઇલમાં **9820649692** આ નંબર **Chitralekha** નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઇલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]